



**POLYLINK POLYMERS  
(INDIA) LIMITED**

CIN NO: L17299GJ1993PLC032905  
AN IS/ISO : 9001 : 2015 COMPANY

**Head Office :**

506, Saffron Building, Near Center Point,  
Ambawadi, Ahmedabad - 380 006.  
Phone : 079-26427800, 26565200  
Tele Fax : 91-79-26421864  
E-mail : polylink@polylinkpolymers.com  
Website : www.polylinkpolymers.com

**Registered Office (Works) :**

Block No. 229-230, Vill - Valthera,  
Dholka-Bagodara Highway,  
Taluka-Dholka,  
Dist.-Ahmedabad-382225

Date: 06<sup>th</sup> February, 2024

To,

**The Secretary,  
Corporate Relationship Department,  
Bombay Stock Exchange,  
1<sup>st</sup> Floor, New Trading Ring,  
Rotunda Building, P.J. Towers,  
Dalal Street,  
Mumbai - 400 001**

**Scrip Code - 531454**

**Sub: Compliance under Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015**

Dear Sir,

We would like to inform you that pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('LODR'), please find enclosed herewith scan copies of newspaper publication of unaudited financial result for the quarter and nine month ended 31<sup>st</sup> December, 2023 as approved in the Board Meeting dated on 05<sup>th</sup> February, 2024 in the following newspapers on 06<sup>th</sup> February, 2024

- The Newline (Gujarati)
- Chanakya Ni Pothi (English)

This is for your information and record purpose.

Yours Faithfully,  
**For Polylink Polymers (India) Limited**

**Raviprakash H Goyal  
Whole Time Director  
DIN: 00040570**

Encl: As above

# ધી ન્યુઝલાઇન

વર્ષ : ૩૦ અંક : ૧૩૩ તા.દ-૨-૨૦૨૪ પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : રણછોડ એન. શાહ સહ તંત્રી : રાધિકા ગંજવાલા

## ખાતર શેરોમાં પણ આકર્ષણ વધવા લાગ્યું

**આઈઆરએફસીનો** શેર અત્યારે તેજમાં આવી ગયો છે



ગયા અંક વખતે ફરી એક વખત રૂ. ૧૬૬ના ભાવે **હુડકોનો** શેર લેવાનું કહ્યું હતું અને તે પછી હુડકોએ અત્યારે રૂ. ૨૦૫નો ભાવ બતાવી દીધો છે. અને આ શેરમાં હવે પ્રોફિટ બુકિંગ શરૂ કરી દેવું. ટ્રેન જ્યારે ઝડપથી દોરે ત્યારે બ્રેક મારે તો પણ થોડા કિલોમીટર ધસી જાય અને તે જ પ્રકારે હુડકોમાં રૂ. ૨૦૮ના લેવલથી પણ એક તબક્કે રૂ. ૨૨૧થી રૂ. ૨૩૧નો ભાવ પહોંચી જાય તો પણ નવાઈ નહિ લાગે અને તેથી નફો કાગળ ઉપર જ ન રહી જાય તે પાસું ધ્યાનમાં રાખીને થોડા થોડા શેરો વેચતા જજો. નવા અહવાલિયા દરમ્યાન આવો જ સુંદર ઉછાળો **યુનિયન બેંક**ના શેરમાં દેખાય છે. રૂ. ૪૨ના ભાવથી લેવાવતા હતા અને અત્યારે રૂ. ૧૪૮.૮૦ ઉપર આવી ગયો છે અને આવતા થોડા દિવસોમાં આ શેરમાં મજબૂત ઉછાળા સાથે રૂ. ૧૫૨ અને તે પછી રૂ. ૧૬૨ના ભાવની સંભાવના મજબૂત છે.

તેવી જ રીતે રૂ. ૨૫૫વાળા **બેંક ઓફ બરોડા**માં પણ જોરદાર આકર્ષણ શરૂ થયું છે. આગામી દિવસોમાં રૂ. ૨૬૦થી રૂ. ૨૭૦નો ભાવ આવી જવાની ગણતરી છે. **કેએમ સુગર**ના શેરમાં પણ આકર્ષણ વધવા લાગ્યું છે અને તેમાં દક્ષિણ ભારતની **સ્વીકો** રૂ. ૮૮.૬૫ના ભાવે આવતા થોડા દિવસોમાં રૂ. ૧૦૦.૬૫ અને **આઈટીસી** રૂ. ૮૩૮ના ભાવે શેરોમાં હવે ભાવ સારા એવા વધી ગયા છે અને તેમાં વધારે લોભ ન રાખતા પ્રોફિટ બુકિંગ શરૂ કરી દેવું.

અમદાવાદની **આશીમા સિલ્વોટિક્સ**નો શેર રૂ. ૨૧.૮૫ ઉપર આવ્યો છે અને આ કંપનીમાં જ કન્સ્ટ્રક્શન કામકાજ શરૂ કરી દેવાય તો નવાઈ નહિ લાગે. કંપની પાસે ખૂબ જ વિશાળ રીયલ એસ્ટેટ છે અને તેને કારણે જો આ ગ્રૂપનો રીયલ એસ્ટેટ મળી રહ્યો છે અને તેમાં શોર્ટટર્મ પેલાડીઓ જોરદાર સક્રિય થઈ ગયા છે. મધ્યમગણે આ શેરમાં આંકડાની અહલાબદલી સાથે રૂ. ૪૮૦નો ભાવ જોવા મળવાની ગણતરી છે અને તેથી પચાસેક શેર લઈને મૂકી શકાય.

**રેડિયન ઇન્ડિયા** અત્યારે રૂ. ૧૮૮ ઉપર ચાલે છે. હેવલેટ પેકાર્ટ અને અન્ય આઈટી કંપનીઓના ઈક્વિટીને ભારત ખાતેનું માર્કેટિંગ અને સર્વિસિંગ કામકાજ રેડિયન દ્વારા થઈ રહ્યું છે. જોરદાર વેચાણો અને સાતત્યપૂર્ણ નફાશક્તિ ધરાવતી આ કંપનીનો શેર અત્યારે રૂ. ૧૮૮માં લઈને મૂકી દો અને તેમાં શોર્ટટર્મમાં જ રૂ. ૧૯૪ અને તે પછી ધીરે ધીરે રૂ. ૨૦૦નો ભાવ જોવા મળે તે સંભાવના મજબૂત છે. શોર્ટટર્મ એન્ગલથી રૂ. ૧૭૮વાળા **ગર્ભલા** શેરમાં પણ જોરદાર કરન્ટ શરૂ થઈ ગયો છે. એક પછી એક સરકારી કંપનીઓની નફાશક્તિ સુધરતી હોવાથી આ પીએસયુ શેરોમાં લેવાલી વધતી જાય છે. ગેઈટમાં પણ નફામાં જોરદાર ઉછાળાની જગ્યા છે. રૂ. ૧૭૮થી ઊંચકીને રૂ. ૧૮૨ અને તે પછીના થોડા દિવસોમાં રૂ. ૧૮૦નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે. તેવી જ રીતે રૂ. ૧૫૩ના ભાવે મળતા **નેશનલ એલ્યુમિનિયમ**ના શેરમાં પણ આકર્ષણ વધ્યું છે. આગામી દિવસોમાં આ શેર ઝડપથી રૂ. ૧૫૮ અને તે પછી ધીરે ધીરે રૂ. ૧૭૪ ઉપર

લાઈફનો શેર અત્યારે ખાસ આકર્ષણ ધરાવે છે. અત્યારના રૂ. ૭૬૧વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં રૂ. ૭૭૦ અને તે પછી રૂ. ૭૮૦નો ભાવ આવવાની ગણતરી છે અને તેથી નાનું રોકાણ કરી શકાય. ઓટોમોબાઈલ શેરો બરાબર દોરી ગયા પછી હવે ખેલાડીઓને ફોકસ ઓટો એન્સિલરી અને ટાયર શેરો ઉપર શિફ્ટ થવા લાગ્યું છે. અને તેમાં રૂ. ૫૪૦વાળો **ઓપોલો ટાયર**નો શેર આવતા થોડા દિવસોમાં ઝડપથી ઊંચકાવાની જગ્યા છે. એક તરફ કૂડના ભાવ પણ ઘટવા છે અને વાહનો વધારે વેચાતા હોવાથી ટાયરના વેચાણો પણ વધ્યા છે. આમ બેતરફના ફાયદાને કારણે રૂ. ૫૪૦વાળો શેર આવતા થોડા દિવસોમાં રૂ. ૫૪૬ અને તે પછી રૂ. ૫૫૬ ઉપર પહોંચી જવાની ગણતરી છે. નાનું રોકાણ કરી શકાય.

બે અહવાલિયા પહેલા **શિવિંગ કોર્પોરેશન**નો શેર પકડી લેવાનું દર્શાવેલું, પરંતુ હવે રૂ. ૨૬૫ ઉપર આવી ગયેલા આ શેરમાં ઝડપથી રોકડી કરી નાખવી, ગમે ત્યારે ભાવ ગબડી પડવાની સંભાવના મજબૂત છે. ખાતર શેરોમાં પણ આકર્ષણ વધવા લાગ્યું છે અને તેમાં દક્ષિણ ભારતની **સ્વીકો** રૂ. ૮૮.૬૫ના ભાવે આવતા થોડા દિવસોમાં રૂ. ૧૦૦.૬૫ અને તે પછી રૂ. ૧૧૦નો ભાવ આવવાની સંભાવના મજબૂત છે.

સરકાર હસ્તકની **એન્જિનિયર્સ ઇન્ડિયા**માં પણ આકર્ષણ વધ્યું છે. અત્યારે રૂ. ૨૬૧ ઉપર છે અને વિવિધ ઓઈલ માર્કેટિંગ કંપનીઓના પ્રોજેક્ટનો ફાયદો એન્જિનિયર્સ ઇન્ડિયાને મળી રહ્યો છે. ૨૬૧થી ઊંચકાઈને રૂ. ૨૬૨ અને તે પછી રૂ. ૨૭૨ ઉપર પહોંચી જાય તે સંભાવના મજબૂત છે. સરકાર હસ્તકની બે કંપનીઓ **એનએચએલ** રૂ. ૧૦૦.૬૫ અને **આઈટીસી** રૂ. ૮૩૮ના ભાવે શેરોમાં હવે ભાવ સારા એવા વધી ગયા છે અને તેમાં વધારે લોભ ન રાખતા પ્રોફિટ બુકિંગ શરૂ કરી દેવું.

અમદાવાદની **આશીમા સિલ્વોટિક્સ**નો શેર રૂ. ૨૧.૮૫ ઉપર આવ્યો છે અને આ કંપનીમાં જ કન્સ્ટ્રક્શન કામકાજ શરૂ કરી દેવાય તો નવાઈ નહિ લાગે. કંપની પાસે ખૂબ જ વિશાળ રીયલ એસ્ટેટ છે અને તેને કારણે જો આ ગ્રૂપનો રીયલ એસ્ટેટ મળી રહ્યો છે અને તેમાં શોર્ટટર્મ પેલાડીઓ જોરદાર સક્રિય થઈ ગયા છે. મધ્યમગણે આ શેરમાં આંકડાની અહલાબદલી સાથે રૂ. ૪૮૦નો ભાવ જોવા મળવાની ગણતરી છે અને તેથી પચાસેક શેર લઈને મૂકી શકાય.

**રેડિયન ઇન્ડિયા** અત્યારે રૂ. ૧૮૮ ઉપર ચાલે છે. હેવલેટ પેકાર્ટ અને અન્ય આઈટી કંપનીઓના ઈક્વિટીને ભારત ખાતેનું માર્કેટિંગ અને સર્વિસિંગ કામકાજ રેડિયન દ્વારા થઈ રહ્યું છે. જોરદાર વેચાણો અને સાતત્યપૂર્ણ નફાશક્તિ ધરાવતી આ કંપનીનો શેર અત્યારે રૂ. ૧૮૮માં લઈને મૂકી દો અને તેમાં શોર્ટટર્મમાં જ રૂ. ૧૯૪ અને તે પછી ધીરે ધીરે રૂ. ૨૦૦નો ભાવ જોવા મળે તે સંભાવના મજબૂત છે. શોર્ટટર્મ એન્ગલથી રૂ. ૧૭૮વાળા **ગર્ભલા** શેરમાં પણ જોરદાર કરન્ટ શરૂ થઈ ગયો છે. એક પછી એક સરકારી કંપનીઓની નફાશક્તિ સુધરતી હોવાથી આ પીએસયુ શેરોમાં લેવાલી વધતી જાય છે. ગેઈટમાં પણ નફામાં જોરદાર ઉછાળાની જગ્યા છે. રૂ. ૧૭૮થી ઊંચકીને રૂ. ૧૮૨ અને તે પછીના થોડા દિવસોમાં રૂ. ૧૮૦નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે. તેવી જ રીતે રૂ. ૧૫૩ના ભાવે મળતા **નેશનલ એલ્યુમિનિયમ**ના શેરમાં પણ આકર્ષણ વધ્યું છે. આગામી દિવસોમાં આ શેર ઝડપથી રૂ. ૧૫૮ અને તે પછી ધીરે ધીરે રૂ. ૧૭૪ ઉપર

લાઈફનો શેર અત્યારે ખાસ આકર્ષણ ધરાવે છે. અત્યારના રૂ. ૭૬૧વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં રૂ. ૭૭૦ અને તે પછી રૂ. ૭૮૦નો ભાવ આવવાની ગણતરી છે અને તેથી નાનું રોકાણ કરી શકાય. ઓટોમોબાઈલ શેરો બરાબર દોરી ગયા પછી હવે ખેલાડીઓને ફોકસ ઓટો એન્સિલરી અને ટાયર શેરો ઉપર શિફ્ટ થવા લાગ્યું છે. અને તેમાં રૂ. ૫૪૦વાળો **ઓપોલો ટાયર**નો શેર આવતા થોડા દિવસોમાં ઝડપથી ઊંચકાવાની જગ્યા છે. એક તરફ કૂડના ભાવ પણ ઘટવા છે અને વાહનો વધારે વેચાતા હોવાથી ટાયરના વેચાણો પણ વધ્યા છે. આમ બેતરફના ફાયદાને કારણે રૂ. ૫૪૦વાળો શેર આવતા થોડા દિવસોમાં રૂ. ૫૪૬ અને તે પછી રૂ. ૫૫૬ ઉપર પહોંચી જવાની ગણતરી છે. નાનું રોકાણ કરી શકાય.

વધતું જાય છે તેમ **સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા**ના રૂ. ૧૨૮વાળા શેરમાં પણ મજબૂત અપ્રેન્ડેન્ડ શરૂ થઈ ગયો છે. જે રીતે તાતા સ્ટીલના ભારતીય યુનિયનમાં નફાશક્તિ સુંદર છે તે જ રીતે સ્ટીલ ઓથોરિટીમાં પણ નફો સારો આવવાની ગણતરી. ધીમા સુધારા સાથે રૂ. ૧૩૫ અને તે પછી રૂ. ૧૪૫નો ભાવ જોવા મળવાની સંભાવના છે. નાનું રોકાણ કરી શકાય.

**રેટ ગોલ્ડ એન્ટરપ્રાઇઝ**નો શેર રૂ. ૮૪૪ ઉપર ચાલે છે અને આ શેરમાં પણ આગામી દિવસોમાં ભાવ ઝડપથી વધીને રૂ. ૮૮૬ અને તે પછી રૂ. ૯૨૮ અને તે પછીના ઉછાળે રૂ. ૧૦૬૨નો ભાવ જોવા મળે તેવી ગણતરી છે. એટલે કે રૂ. ૫૦-૫૦ની ત્રણ નોટો થોડા દિવસોમાં જ આ શેર આવી શકશે. ગયા અહવાલિયા **સંગમ ઇન્ડિયા**નો શેર પકડી લેવાનું કહ્યું હતું. રાજસ્થાનમાં આધુનિક ટેક્સટાઈલ મિલ ધરાવતી આ કંપનીનો શેર અત્યારે રૂ. ૫૮૫ ઉપર આવ્યો છે અને તેમાં હજી છેલ્લા ઉછાળામાં રૂ. ૬૩૭ અને તે પછીના ઉછાળે રૂ. ૬૮૦નો ભાવ જોવા મળે તે સંભાવના ખૂબ મજબૂત છે અને તેથી નાનું રોકાણ કરી શકાય.

**હર્ષા સ્ટીલ**નો શેર રૂ. ૧૩૫ ઉપર છે. એરપોર્ટ બિઝનેસ હાથમાંથી જતો રહ્યા પછી વ્યાજનો ભોજો નથી રહ્યો અને તેથી કેવળ પાવર પ્લાન્ટવાળી આ કંપનીમાં નફાશક્તિ ઝડપથી સુધરવાની જગ્યા છે. એક વખત રૂ. ૧૩૮.૮૦ને લેવલ પસાર થાય તે પછી આ શેરમાં ભાવ ઝડપથી રૂ. ૧૪૭.૭૫ અને તે પછી ધીરે ધીરે રૂ. ૧૬૦નો ભાવ જોવા મળવાની ગણતરી છે.

**નેવેલી લિનાઈટ** અત્યારે રૂ. ૨૬૫ ઉપર છે અને જે રીતે એનએમસીના શેરમાં આકર્ષણ વધ્યું છે તે રીતે સાચા અર્થમાં આ શેર મહિનાઓ સુધી બેઠો રહે અને હવે ગાંડાની જેમ દોડવા લાગ્યો છે. રૂ. ૨૫૩વાળા આ શેરમાં તોફાની તેજની સંભાવના, મંદી રમવાની મૂર્ખાની નહિ કરવી, આગામી દિવસોમાં રૂ. ૨૮૫ અને તે પછીના થોડા દિવસોમાં રૂ. ૩૦૩ના ભાવની આરએસની વાત.

**તાતા મોર્ટર**, આ શેર પણ તોફાની તેજમાં આગળ વધતો જાય છે. જયુઆર અને લેન્ડરોવરમાં સુંદર વેચાણો, ટૂંકના વેચાણો પણ વધ્યા છે અને હવે માર્ચ ક્વાર્ટરમાં ઈલેક્ટ્રિક બસના વેચાણો પણ સુંદર ઉછાળો જોવાશે. રૂ. ૮૭૮ વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં રૂ. ૯૦૮ અને તે પછી રૂ. ૯૨૨નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે.

**ઓપોલો હોસ્ટિલ**, મેડિકલ ટુરિઝમ જોરદાર પોસ્ટવર, કંપનીના નફામાં સુંદર વૃદ્ધિ, રૂ. ૬૨૮ના ભાવે આકર્ષક, આવતા થોડા અહવાલિયામાં રૂ. ૬૪૨ અને તે પછીના ઉછાળે રૂ. ૬૫૩ના ભાવની સંભાવના મજબૂત છે. બે કે ત્રણ શેર લઈને મૂકી શકાય.

**સન ફર્મા**, ધીમા સુધારા સાથે રૂ. ૧૪૦૭નો ભાવ તો આવી ગયો, ચાણક્યની વાત મુજબ ધીરે ધીરે આ શેરે રૂ. ૨૦૦૦ ઉપર પહોંચવાનું છે. આગામી દિવસોમાં ધીમા અપ્રેન્ડેન્ડ સાથે રૂ. ૧૪૨૪ અને તે પછી રૂ. ૧૪૪૪નો ભાવ જોવા મળવાની ગણતરી.

**કેનેરા બેંક**, ઘણા સમયથી આ શેર માટે યોગ્ય ભાવ રૂ. ૭૦૦ હોવાનું દર્શાવીએ છીએ. રૂ. ૫૦૧નો ભાવ તો આવી ગયો. જાળવી રાખજો. લીધા ન હોય તો અત્યારના ભાવે પણ થોડાક શેરો લઈને મૂકી દેવાય. આવતા થોડા દિવસોમાં રૂ. ૫૨૦ અને તે પછી રૂ. ૫૪૫નો ભાવ જોવા મળવાની ગણતરી.

**બેંક ઓફ બરોડા**, રૂ. ૨૫૬ના ભાવે પણ મફત છે. ૧૦૦-૨૦૦-૫૦૦ શેર લઈને મૂકી શકાય અને આગામી દિવસોમાં ધીમા અપ્રેન્ડેન્ડ સાથે રૂ. ૨૬૬ અને તે પછી રૂ. ૨૮૬નો ભાવ જોવા મળવાની ગણતરી. નાનું રોકાણ ખૂબ જ સલાહભરેલું.

**ગોદેશ્વર કન્ટ્રીયુર**, રૂ. ૧૨૫વાળા આ શેરમાં સુંદર ટેન્સી, અને આગામી દિવસોમાં ધીરે ધીરે રૂ. ૧૩૬ અને તે પછી રૂ. ૧૪૬ના ભાવની સંભાવના મજબૂત છે. નાનું રોકાણ કરી શકાય.

**સ્ટીપર્સ ઇન્ડિયા**, ટ્રાન્સમિશન ટાવરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ મોટું નામ, ઓટોમોબાઈલમાં અત્યારે સુંદર વેચાણો રૂ. ૭૦ના ભાવે ૧૦૦-૨૦૦ શેર લઈને મૂકી દેવાય આગામી દિવસોમાં સુંદર ઉછાળા સાથે રૂ. ૩૫૦ અને તે પછી ધીરે ધીરે રૂ. ૪૦૦ના ભાવની સંભાવના મજબૂત છે.

**મધરસન સુમી વાઈટિંગ**, ઓટોમોબાઈલ સેક્ટર સાથે સીધો સંબંધ, ઓટોમોબાઈલમાં અત્યારે સુંદર વેચાણો રૂ. ૭૦ના ભાવે ૧૦૦-૨૦૦ શેર લઈને મૂકી દેવાય અને આવતા થોડા અહવાલિયામાં રીટર્નિંગ સાથે રૂ. ૮૦ અને તે પછી રૂ. ૮૪ના ભાવની ગણતરી, ૨૦ ટકા ડિવિડેન્ડ થયું.

**ડ્રાઈવર ?**

ડ્રાઈવર, રસોયા, નોકર શોધવા હવે ખૂબ જ સરળ staffavailable.com

ના એકદમ અલગ પ્રકારના અને દેશમાં એકમાત્ર આવી સવાલ એફક કલ્પતા પ્લેટફોર્મ ઉપર તમારી જરૂરિયાત મૂકી દો

**તદ્દન ફી** staffavailable.com

છે તે જ રીતે તામિલનાડુની **એનએલસી ઇન્ડિયા**માં પણ આવતા થોડા દિવસોમાં રૂ. ૨૮૪ અને તે પછી રૂ. ૩૦૩ અને તે પછી રૂ. ૩૧૭નો ભાવ જોવા મળે તે સંભાવના મજબૂત છે.

**ઓલેક્ટ્રા** અત્યારે રૂ. ૧૭૮૭ ઉપર છે અને માર્ચ આપર નજીક હોવાને કારણે આ કંપનીને પણ ઈલેક્ટ્રિક બસના મોટા ઓર્ડરો મળી શકશે અને તે પાછળ આવતા થોડા દિવસોમાં રૂ. ૧૮૪૮ અને તે પછી રૂ. ૧૮૧૮નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે. પાંચ કે દસ શેરનું કામકાજ કરી શકાય.

રૂ. ૨૮૪વાળા **ગાલમર લોરી**ના શેરમાં પણ આગામી દિવસોમાં ભાવ ઝડપથી વધીને રૂ. ૨૮૦ અને તે પછી રૂ. ૩૦૪ સુધી પહોંચી જાય તે સંભાવના મજબૂત છે. ગયા અંક વખતે **તાતા પાવર**નો શેર રૂ. ૩૬૮ના ભાવે લેવાયેલો અને અત્યારે આ શેર રૂ. ૩૮૦ ઉપર આવી ગયો છે. હવેના ઉછાળાના છેલ્લા તબક્કામાં આ શેરમાં રૂ. ૪૦૦ અને તે પછી રૂ. ૪૦૪નો ભાવ જોવા મળવાની સંભાવના છે. રૂ. ૪૦૪ આસપાસ આ શેરમાં પ્રોફિટ બુકિંગ શરૂ કરી શકાય. રૂ. ૬૩૪વાળી **એલઆઈસી હાઈસીંગ ફિનાન્સ**માં પણ આવતા થોડા દિવસોમાં સુંદર ઉછાળા સાથે રૂ. ૬૬૮ અને તે પછી રૂ. ૬૮૬નો ભાવ જોવા મળવાની ગણતરી છે. આ શેર માટે રૂ. ૭૦૦ ધસનો ભાવ યોગ્ય કહી શકાય.

રૂ. ૧૪૩.૮૦વાળી **ગ્રીમેટોનો** શેર શાંતિપૂર્વક પકડી રાખવો અને શક્ય હોય તો ભેગા પણ કરવા, આવતા થોડા દિવસોમાં રૂ. ૧૪૭ અને તે પછી રૂ. ૧૫૨નો ભાવ દેખાય છે.

સિમેન્ટ શેરોમાં મજબૂત અપ્રેન્ડેન્ડ શરૂ થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કૂડના ભાવ છેલ્લા ત્રણ મહિનાથી સતત ઘટી રહ્યા છે અને સિમેન્ટના કુલ ખર્ચમાં ફ્યુઅલ ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ખૂબ જ મોટો હિસ્સો ધરાવે છે અને તેથી સ્વાભાવિક છે કે કૂડ ઘટવાને કારણે મોટા ભાગની સિમેન્ટ કંપનીઓની નફાશક્તિમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં સુંદર ઉછાળો જોવાયો હતો અને હવે માર્ચ ક્વાર્ટર દરમ્યાન પણ સિમેન્ટ કંપનીઓના પરિણામો ખૂબ જ પ્રોત્સાહક આવવાની ગણતરી છે.

બીજી તરફ રીયલ એસ્ટેટ અત્યારે ભડકે બળી રહ્યું છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ અનેક નવા પ્રોજેક્ટો આગળ વધી રહ્યા હોવાથી સિમેન્ટની માંગમાં તોર્તાઈગ ઉછાળો જોવાયો છે. વિવિધ રાજ્યો અને મેટ્રો શહેરોની વાત કરીએ તો હવે ડામરના રસ્તાને બદલે અનેક રસ્તાઓ ધીરે ધીરે સિમેન્ટમાં રૂપાંતર કરવામાં આવી રહ્યા છે અને તેને કારણે પણ આવતા પાંચ વર્ષ દરમ્યાન મેટ્રો શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સિમેન્ટની માંગમાં ખૂબ જ સુંદર ઉછાળો જોઈ શકશે.

સિમેન્ટ સેક્ટરની ટોચની કંપની **અલ્ટ્રાટેક સિમેન્ટ** અત્યારે રૂ. ૯૮૨૨



SR. NO.	PARTICULARS	Quarter Ended 31.12.2023	Quarter Ended 30.09.2023	Quarter Ended 31.12.2022	Nine Months Ended 31.12.2023	Nine Months Ended 31.12.2022	Year Ended 31.03.2023
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Revenue from operations	1,886.53	1,743.20	1,092.59	5,228.09	3,631.51	5,036.14
2	Other Income	10.08	4.38	3.30	17.60	24.81	28.27
3	Total Income (1+2)	1,896.61	1,747.58	1,095.89	5,245.69	3,656.32	5,064.71
4	Total Expenses	1,833.48	1,727.24	1,095.36	5,123.61	3,615.24	4,968.07
5	Profit/(Loss) from ordinary activities before exceptional items and tax (3-4)	63.13	20.34	0.53	122.08	41.08	96.64
6	Exceptional Item	-	-	-	-	-	-
7	Profit/(Loss) before tax (5+6)	63.13	20.34	0.53	122.08	41.08	96.64
8	Tax Expenses	17.75	(0.97)	0.13	27.88	15.82	32.23
9	Net Profit/(Loss) for the period (7-8)	45.38	21.31	0.40	94.20	25.26	64.41
10	Other Comprehensive Income (net of tax)	-	-	-	-	-	(6.02)
11	Total Comprehensive Income for the period (9+10)	45.38	21.31	0.40	94.20	25.26	58.39
12	Paid up Equity share capital	1105.58	1105.58	1105.58	1,105.58	1,105.58	1,105.58
13	Other Equity	-	-	-	-	-	-
14	Earnings per share (nominal value of Rs, 5 each) for the quarters not annualised (a) Basic (Rs) (b) Diluted (Rs)	0.210 0.210	0.10 0.10	0.00 0.00	0.43 0.43	0.11 0.11	0.29 0.29

**POLYLINK POLYMERS (INDIA) LIMITED**  
 CIN : L17299GJ1993PLC032905  
 Regd. Office & Works : Block No. 229-230, Valthera, Tal - Dholka, Dist. - Ahmedabad-387810  
 Phone No.079-26427800 FAX No.079-26421864  
 Email: polylink@polylinkpolymers.com; website: www.polylinkpolymers.com  
 Extract of Unaudited Financial Results for the Quarter & Nine Months Ended 31st December 2023 (Rs. in Lacs)

**Notes:**  
 1. The above is an extract of the detailed format of the unaudited financial results for the quarter and nine months ended 31st December 2023, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited financial results along with review report of the Statutory Auditors is available under Investors section of our website at www.polylinkpolymers.com and under Financial Results at Corporate section of www.bseindia.com

By order of the Board of Polylink Polymers (India) Limited  
 Sd/-  
 Raviprakash Harishankar Goyal  
 Whole Time Director  
 DIN: 00040570

Date : 5th February, 2024  
 Place : Ahmedabad

## Fintech major Paytm denies reports on violation of foreign exchange rules

One97 Communications Ltd (OCL), the parent company of fintech major Paytm, denied reports about investigation or violation of foreign exchange rules by the company or its associate Paytm Payments Bank Limited.

“One97 Communications Ltd (OCL) denies reports of investigation or violation of Foreign Exchange rules by the company or its associate Paytm Payments Bank Limited. To address recent misinformation, factual inaccuracies, and speculation, One97 Communications Limited (OCL / Paytm / company) would like to set out the company’s position and directly address rumours in the recent misleading media reports about the company,” it said in an exchange filing.

On Monday, media reports quoting sources claimed that the Enforcement Directorate (ED) was investigating if platforms run by OCL were involved in violations of the Foreign Exchange Management Act (FEMA).

The company, in an exchange filing on Sunday, had denied reports about any investigation by ED into the company, its associates, and its founder and chief executive officer (CEO), Vijay Shekhar Sharma.

The company said it had cooperated with the authorities when users or merchants on its platform were subject to enquiries in the past.

“We would like to set the record straight and deny any involvement in anti-money laundering activities. We continue to abide by Indian laws and take regulatory orders with utmost seriousness,” OCL said in a separate filing on Sunday.

On January 31, the Reserve Bank of India (RBI) said no further deposits or credit transactions or top-ups would be allowed in customer accounts, prepaid instruments, wallets, FASTags, National Common Mobility Card (NCMC) cards, etc., after February 29, 2024, other than any interest, cashback, or refunds that may be credited at any time.

Earlier, in March 2022, the RBI had directed Paytm Payments Bank to stop taking on board new customers on account of alleged know your customer (KYC) violations and appoint an audit firm.

Violations of KYC norms, leading to money laundering concern, have prompted the RBI to clamp down on Paytm Payments Bank, sources told last week. According to reports, part of the concern included

allegedly not maintaining an arm’s length with promoter group OCL, not disclosing payments to promoters, false submission of compliance, and overall disregard for compliance and transparency.

Major irregularities were found in the KYC process, which potentially put customers, including depositors, at risk, the paper reported last week.

KYC norms were allegedly not followed in a large number of accounts, and there were failures in validating permanent account numbers (PANs) in numerous accounts. There were thousands of cases where a single PAN was linked to over 100 customers, and in some cases more than a thousand customers.

In addition, there were transactions in minimum KYC pre-paid instruments which were beyond the regulatory limits, raising money laundering concern. Unusually high numbers of dormant accounts, which could have been used as mule accounts, too were a reason for concern.

Deficiencies in the KYC process and lack of transaction monitoring added to money laundering concern. Accounts and wallets running into hundreds of thousands were frozen.

## Vanguard slashes Ola's valuation by another 29% to \$1.88 billion

The US-based investment management firm Vanguard has adjusted the valuation of the mobility company Ola to \$1.88 billion. This represents the third markdown in the valuation of the firm led by Bhavish Aggarwal by Vanguard since February 2023.

According to regulatory filings with the US Securities and Exchange Commission (SEC), Vanguard has revised Ola’s parent company, ANI Technologies, to \$1.88 billion as of November 30, 2023. This is a 29 per cent decrease from its previous fair value of \$2.65 billion as of August 31 last year.

Vanguard’s latest fair value of \$1.88 billion is 74 per cent lower than the last valuation at which the company raised funds.

In February last year, Vanguard marked down the valuation of ANI Technologies by about 34 per cent to \$4.8 billion from \$7.3 billion. Later, Vanguard further reduced its holding by another 52.7 per cent to \$3.5 billion in its July disclosure.

Vanguard holds about a 0.7 per cent stake in the ride-hailing firm. The company did not comment on the valuation slash by Vanguard.

In December 2021, the mobility platform raised about \$139 million from a few investors, including IIFL, Edelweiss, and Sunil Munjal-led Hero Enterprise. This information is based on regulatory documents sourced from the business intelligence platform Tofler. Ola had been

valued at about \$7.3 billion at that time.

Ola recently announced that its India mobility business turned earnings before interest, tax, depreciation, and amortisation (Ebitda) positive in 2022-23 (FY23), making it one of the few Indian internet companies to achieve this feat.

For the consolidated entity, revenue from operations and other income for FY23 stood at Rs 3,000 crore compared to Rs 2,120 crore in 2021-22 (FY22). The Ebitda loss for the consolidated entity, excluding discontinued business, was reduced to Rs 29 crore in FY23 from Rs 291 crore in FY22.

ANI Technologies standalone (Ola’s India mobility business) total revenue has

continued on Pg no. 2

## GAIL's stronger-than-expected Q3FY24 performance may be priced in

GAIL reported Ebitda of Rs 3,820 crore in the October-December quarter (Q3FY24), driven by stronger-than-expected performances in the gas transmission, LPG, and petchem segments.

This was a huge improvement on Ebitda of Rs 260 crore year-on-year (Y-o-Y). The PAT stood at Rs 2,840 crore, which was also a beat and around 12x better than Rs 250 crore Y-o-Y. For the first nine months (9M) of FY24, GAIL’s revenue stood at Rs 98,300 crore (down 12 per cent Y-o-Y). Ebitda was at Rs 9,750 crore (up 52 per cent Y-o-Y), and PAT stood at Rs 6,660 crore (up 42 per cent Y-o-Y).

The management claimed improved realisation was key and higher petrochemical sales, improved marketing margins, and reduced petchem costs contributed to the good performance. GAIL anticipates robust gas demand, projecting transmission volumes will be 124 mmscmd (million metric standard cubic meters per day) by the end of FY24.

Forecasts indicate annual growth of 10-12 per cent in

volumes for FY25 and FY26, with estimates of 133 mmscmd (FY25) and 141 mmscmd (FY26), respectively. The optimal costs for the petrochemical segment is \$8-9 per mmBu (metric million British Thermal Unit), and the company is currently procuring supplies at this sweet spot. The petchem plant utilisation level is at 101 per cent.

In segment analysis, gas transmission reported Ebit (earnings before interest and tax) of Rs 1,220 crore and LPG transmission Ebit was at Rs 79.4 crore (down 13 per cent Y-o-Y). Trading business posted an Ebit of Rs 1,880 crore (versus loss of Rs 86 crore in Q3FY23).

The petchem segment posted an Ebit of Rs 62 crore versus loss of Rs 349 crore in Q3FY23. The HIFY24 saw Ebit losses of Rs 460 crore in the petchem segment but management believes that FY24 will be at breakeven as Ebit is expected to surge in Q4FY24.

The LPG & Hydrocarbon segment reported an Ebit of Rs 258 crore versus loss of Rs 29 crore in Q3FY23. There’s likely to be a substantial improvement in the petchem segment’s

profitability over the period September 2024 to FY26 as new capacity of 560,000 tonnes per annum will be operational and low global inventories will drive demand. Around 3,900 km of gas transmission pipelines will also become operational.

Projecting forward, transmission will continue to be steadily profitable as volumes rise, while the petchem cycle has seen a turnaround. The ROCE (return on capital employed) has risen by around 300 bps Y-o-Y to approximately 11 per cent in the 9MFY24 and the RoE (return on equity) is up by around 500 bps. Net debt is expected to decline and the debt:equity ratio would be close to 0.03 as free cash generation rises.

Analysts have upgraded the earnings estimates and target valuations accordingly as the results and management commentary were absorbed.

Target valuations range from around Rs 145-200 which is a very wide range. However, the stock also surged about 10 per cent to Rs 181.40 post Q3 results last Monday, and the upside may be priced in.

## Bharti Airtel Q3 results: Consolidated net profit rises 54% to Rs 2,442 cr

Bharti Airtel on Monday posted a 54 per cent jump in consolidated net profit at Rs 2,442.2 crore during the October-December quarter of 2023. It had registered a profit of Rs 1,588.2 crore in the year-ago period, the company said on Monday.

Driven by strong 4G and 5G customer additions, the telecom service provider’s consolidated revenue for Q3 was Rs 37,899 crore, a 5.85 per cent increase on a year-on-year (Y-o-Y) basis.

But vis-à-vis Q2FY24, net sales were up by 2.3 per cent. Other income during the quarter under review stood at Rs 439.8 crore.

The company’s average revenue per user (ARPU), a key performance metric for telecom firms, rose 7.7 per cent Y-o-Y to Rs 208, up marginally from Rs 203 in the preceding quarter.

Airtel’s ARPU is the highest among India’s top telecom players, beating Jio’s Rs 181.7 and Vodafone Idea’s Rs 145 (as last reported by both companies).

The company’s India revenue for Q3FY24 was Rs 27,811 crore, up by 11.4 per cent Y-o-Y. The growth rate, however, was less than the 13 per cent increase seen in the preceding quarter.

Mobile services in India, which account for a significant portion of the revenue, grew at 11.8 per cent Y-o-Y in Q3 due to strong additions of 4G/5G customers. This was slightly faster than the 10.9 per cent growth seen in Q2. The telco’s consolidated earnings before interest, taxes, depreciation, and amortisation (Ebitda)

during the quarter was Rs 20,044 crore. Ebitda margin was 53.9 per cent, up 94 basis points (bps) Y-o-Y.

The India business posted an Ebitda of Rs 15,000 crore, with a margin of 53.9 per cent, up 119 bps.

“The quarter witnessed a strong growth trajectory for the postpaid and home businesses, while our direct-to-home (DTH) business saw 388,000 net adds — the highest in the last 12 quarters. We remain on course with our strategy of premiumisation that helped us add 7.4 million 4G/5G customers and exit the quarter with an industry leading ARPU of Rs 208,” said Gopal Vittal, managing director of Bharti Airtel.

Even at this ARPU, the return on capital employed (RoCE) however, continues to be low at 9.4 per cent, Vittal added.

The telco added 0.9 million subscribers in Q3, slightly down from 1 million in Q2.

Airtel rolled out 12,300 new towers over the past quarter to further strengthen network coverage. The company has rolled out 45,000 towers in the first nine months of FY24.

On a consolidated basis, 4G/5G data customers were up by 28.2 million Y-o-Y, now making up 71 per cent of the overall mobile customer base.

Airtel’s homes business maintained its rapid growth trajectory and delivered a revenue growth of 23 per cent Y-o-Y.

Mobile data consumption increased by 21.1 per cent Y-o-Y with consumption per customer rising to 22 GB per month in India.

## upGrad commits Rs 100 crore for 100 'connect and counselling' hubs

Ronnie Screwvala-led educational technology unicorn upGrad is opening 100 offline ‘connect and counselling’ touchpoints and ‘learning centres’ in the country to enhance its online growth. The first two counselling centres have already been inaugurated in Mumbai and Delhi, while the first two learning centres are established in Indore and Pune.

Initial reactions have been strong, with over 500 career counselling sessions in the first 30 days. The goal is for the 100 centres to counsel over half a million individuals on their career moves. The learning centres are expected to witness enrolments of over 10,000 learners. The company has earmarked an initial corpus of Rs 100 crore to further expand across non-metros and smaller towns and accelerate operations in the next 12 months. It plans to establish 75 counselling centres, with the remaining 25 centres focusing on learning. This initiative supplements upGrad’s existing offline presence with over 50 franchises and 150 channel partners.

Mayank Kumar, co-founder and managing director of upGrad, said in an interview, “We believe that the online channel has its own set of limitations and challenges for scaling up. From a growth and strategic perspective, we are now focusing on establishing

a stronger offline presence for upGrad. Establishing these centres will bring us closer to customers who still prefer learning at a physical centre.”

Kumar anticipates that setting up these learning and counselling centres alone will generate revenue of about Rs 1,000 crore in three to four years. He highlighted India’s unique position to dominate global talent markets and emphasised the company’s efforts to provide career guidance and high-quality learning to every age group through carefully integrated offerings in the current financial year. The centres will serve as hubs for career counselling, providing access to all of upGrad’s courses and programmes in one place for those looking to upskill and reskill. Kumar said, “We’ve identified high-demand geographic pockets that will allow talents beyond metros to experience the sincere handholding they need in their lifelong learning journey.”

upGrad reported revenue of Rs 1,194 crore in 2022-23 (FY23), a 96 per cent increase from Rs 608 crore in 2021-22 (FY22). The company moved to the widely accepted IndAS accounting standard in 2022-23 (FY23) in line with its listing plans.

On an annual recurring revenue basis, the company recently mentioned that the revenue would have been higher, but some mergers and acquisitions did not consolidate in FY23.

## UPL stock slumps 11% on weak Q3 performance, triggers downgrades

The stock of the country’s largest agrochemical company by revenues, UPL, fell 11 per cent in trade on Monday after posting a weaker-than-expected December quarter performance.

While expectations on the performance in the third quarter were low, the results undershot even these estimates. The Street is worried that a weak operational performance going ahead could lead to higher working capital and weigh on cash flows. Some brokerages have cut their estimates and downgraded the stock.

Revenues of the company fell 28 per cent year on year (Y-o-Y) on the back of pricing pressures across markets. Fall in agrochemical prices led to inventory destocking by distributors which hit volumes. While prices fell 24 per cent, volumes slipped 4 per cent for UPL.

Sales of its largest market, Latin America, was down 28 per cent due to pricing challenges in key herbicides and insecticides in Brazil. Sales in the Indian market slumped 20 per cent due to higher sales return in key crops of cotton and pulses which saw lower acreages in North India.

UPL stock fertiliser q3 Low demand for glufosinate (herbicide) compared to last

year due to dry kharif and rabi seasons, higher channel stock and increased competition also impacted performance.

Among major markets, North America was the worst-hit, falling 64 per cent due to channel destocking, lower prices and higher rebates. Rest of the world markets, led by China (insecticides) and Turkiye (herbicides), were the only segments to report growth in revenues at 12 per cent.

Lack of operating leverage and a steep fall in gross margins by 1,670 basis points led to its operating profit declining by 86 per cent. Operating profit margin was down 18 percentage points to 4.2 per cent. Weak operational performance, higher interest costs and unfavourable forex led to a loss of Rs 1,217 crore.

Gross debt increased by Rs 3,370 crore as compared to the year ago quarter to Rs 36,173 crore while net debt adjusted for forex impact rose by Rs 3,637 crore Y-o-Y to Rs 31,165 crore.

The company expects its March quarter performance to be weaker as compared to the year-ago quarter. The performance is expected to gradually recover by the second quarter of FY25.

Post the results, Rohan Gupta and Rohan Ohri of

Nuvama Research have downgraded the stock to reduce.

Margin contraction, persistent weakness in its key markets of the US and Brazil, and inventory destocking continuing for two-three quarters shall put margin under pressure.

This along with an increase in working capital and delays in receivables would pressure cash flows. Though UPL has plans to raise money through a rights issue of up to \$500 million to repay debt, the analysts believe there is risk of credit ratings downgrade in the near term, given increase in its net debt to operating profit to 5.3 times in FY24.

Motilal Oswal Research has cut its earnings estimates by 23 per cent for FY25. Analysts led by Sumant Kumar of the brokerage say that there are near-term challenges in the global agrochemical industry due to an accumulation of high inventory as distributors opt for need-based tactical purchases, and declining agrochemical prices led by aggressive price competition from Chinese (post-patent) exporters.

Considering the short-term challenges, cash flow generation and debt repayments remain the key monitorables, they added.

## Delhi High Court tells SpiceJet to pay Rs 50 crore to Kalanithi Maran

The Delhi High Court on Monday told low-cost carrier SpiceJet Ltd to pay Rs 50 crore to former promoter Kalanithi Maran and KAL Airways within six weeks, as part of an arbitral award of 2018.

The court said the payment shall be made subject to the outcome of SpiceJet’s appeal challenging the interest amount awarded by the arbitral tribunal. The matter will now be heard on May 14.

A single judge of the court on July 31 last year refused to interfere with the 2018 arbitral tribunal award that asked SpiceJet to refund Rs 579 crore with interest accrued to Maran in the share transfer dispute. SpiceJet had last year told

the Delhi High Court that it was ‘struggling to stay afloat’ after the low-cost carrier was ordered to make a payment to its former owner Kalanithi Maran over money owed.



Senior Advocate Maninder Singh, appearing for Maran and KAL Airways, told the court that the carrier would pay Rs 194 crore but has not done so, and now the amount with interest is Rs 250 crore. Singh sought an attachment of Rs 194

crore lying in SpiceJet’s YES Bank account.

The court refused to pass any attachment order and said, “Today, they (SpiceJet) are a running company, this will sink them. I know that money needs to be paid, I am giving them breathing space. I can order payment of Rs 194 crore, but it will sink them.”

SpiceJet’s appeal against the interest payable to Maran is pending before another bench of the high court.

The case relates to a share transfer dispute between SpiceJet’s chairman and managing director Ajay Singh and Maran and his KAL Airways. The matter was referred to arbitration.

POLYLINK POLYMERS (INDIA) LIMITED							
CIN : L17299GJ1993PLC032905							
Regd. Office & Works : Block No. 229-230, Valthera, Tal - Dholka, Dist. - Ahmedabad-387810							
Phone No.079-26427800 FAX No.079-26421864							
Email: polylink@polylinkpolymers.com; website: www.polylinkpolymers.com							
Extract of Unaudited Financial Results for the Quarter & Nine Months Ended 31st December 2023 (Rs. in Lacs)							
SR NO.	PARTICULARS	Quarter Ended 31.12.2023	Quarter Ended 30.09.2023	Quarter Ended 31.12.2022	Nine Months Ended 31.12.2023	Nine Months Ended 31.12.2022	Year Ended 31.03.2023
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Revenue from operations	1,886.53	1,743.20	1,092.59	5,228.09	3,631.51	5,036.14
2	Other Income	10.08	4.38	3.30	17.60	24.81	28.27
3	Total Income (1+2)	1,896.61	1,747.58	1,095.89	5,245.69	3,656.32	5,064.71
4	Total Expenses	1,833.48	1,727.24	1,095.36	5,123.61	3,615.24	4,968.07
5	Profit/(Loss) from ordinary activities before exceptional items and tax (3-4)	63.13	20.34	0.53	122.08	41.08	96.64
6	Exceptional Item	-	-	-	-	-	-
7	Profit/(Loss) before tax (5+6)	63.13	20.34	0.53	122.08	41.08	96.64
8	Tax Expenses	17.75	(0.97)	0.13	27.88	15.82	32.23
9	Net Profit/(Loss) for the period (7-8)	45.38	21.31	0.40	94.20	25.26	64.41
10	Other Comprehensive Income (net of tax)	-	-	-	-	-	(6.02)
11	Total Comprehensive Income for the period (9+10)	45.38	21.31	0.40	94.20	25.26	58.39
12	Paid up Equity share capital	1105.58	1105.58	1105.58	1,105.58	1,105.58	1,105.58
13	Other Equity	-	-	-	-	-	1,503.27
14	Earnings per share (nominal value of Rs. 5 each) (for the quarters not annualised)						
	(a) Basic (Rs)	0.210	0.10	0.00	0.43	0.11	0.29
	(b) Diluted (Rs)	0.210	0.10	0.00	0.43	0.11	0.29

**Notes:**  
1. The above is an extract of the detailed format of the unaudited financial results for the quarter and nine months ended 31st December 2023, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited financial results along with review report of the Statutory Auditors is available under Investors section of our website at www.polylinkpolymers.com and under Financial Results at Corporate section of www.bseindia.com

**By order of the Board of Polylink Polymers (India) Limited Sd/-**  
Raviprakash Harishankar Goyal  
Whole Time Director  
DIN: 00040570

Date : 5th February, 2024  
Place : Ahmedabad